

# સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત

રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર

ખેલ મહાકુંભ ૩.૦

(ફોર્મ-અ)

વ્યક્તિગત રમત તથા સાંધિક રમત માટેનું પ્રવેશપત્ર (કોઈ પણ બે રમતમાં તથા વજન ગ્રુપમાં અને એકજ વયજૂથમાં ભાગ લઈ શકાશે) અં-૯ અંડર-૧૧, અંડર-૧૪, અંડર-૧૭ સ્પર્ધા માટે શાળા મારફત રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.																	
					KMK ID:												
					આધાર ડાટાસ નંબર												
૧. શાળા/કોલેજ નું નામ*																	
૨. વય જૂથ* (૩૧-૧૨-૨૦૨૪ની સ્થિતિએ)																	
અં-૯		અં-૧૧		અં-૧૪		અં-૧૭		ઓપન એજ ગ્રુપ		અબવ-૪૦		અબવ-૬૦		ભાઈઓ		બહેનો	
૩. રમતનું નામ*																	
૪. સબ ઈવેન્ટ*																	
૧.ખેલાડીનું નામ*																	
૨.જન્મ તારીખ*																	
૫.મોબાઇલ નંબર* :																	
૬.ઇ-મેઇલ આઇ.ડી* :																	
૭. વાલીનું નામ:																	
૮. ઘરનું સરનામું :																	
૯. જિલ્લો/મહાનગરપાલિકા*																	
૧૦. બેન્કની વિગત																	
૧૧. આધાર કાર્ડ નંબર																	
૧૨. કોચ/વ્યાયામ શિક્ષકનું નામ																	
૧૩. કોચ/વ્યાયામ શિક્ષકનાં ઘરનું સરનામું:																	
૧૪. કોચ/વ્યાયામ શિક્ષકનો મોબાઇલ નંબર:																	
નોંધ :- *ચિન્હ કરેલી વિગતો ભરવી ફરજિયાત છે.																	

## રજિસ્ટ્રેશન અંગે સુચનાઓ

- અંડર-૯, અંડર-૧૧, અંડર-૧૪, અંડર-૧૭ સ્પર્ધા માટે શાળા મારફત રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.
- ઓપન એજ ગ્રુપ, તથા અભ્યાસ ન કરતા હોય તેવા ખેલાડીઓએ પોતાનું રજીસ્ટ્રેશન (૧) જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, (૨) વેબપોર્ટલ <https://khelmahakumbh.gujarat.gov.in> મારફતે કરાવવાનું રહેશે.

## બાહેધરી:-

- સ્પર્ધા દરમિયાન કોઈ પણ જાતની શારીરિક હાની થશે તો તેની જવાબદારી મારી અને મારા વાલીની રહેશે. આયોજકની કોઈ જવાબદારી રહેશે નહીં.
- હું રજીસ્ટ્રેશન સમગ્ર રાજ્યમાંથી ફક્ત એક જ સ્થળેથી કરીશ અન્યથા મારું રજીસ્ટ્રેશન રદ બાતલ ગણાશે.
- હું આથી બાહેધરી આપુ છું કે જો હું ખેલ મહાકુંભમાં વિજેતા/પસંદગી પામીશ તો સ્પર્ધા સ્થળે મારા જોખમે દર્શાવેલ સમય કરતાં પહેલાં ઉપસ્થિત રહીશ.
- વ્યક્તિગત રમતની સબ ઈવેન્ટ માટે પાછળના પૃષ્ઠ પર આપેલ ઈવેન્ટમાં  નું નિશાન કરવું.
- વ્યક્તિગત રમત માટે ફોર્મ-અ અને સાંધિક રમત માટે ફોર્મ-અ અને ફોર્મ-બ ભરવું ફરજિયાત છે.
- ટેબલ ટેનીસ, લોન ટેનીસ, બેડમીન્ટન ડબલ્સ અને મિક્સ ડબલ્સ માટે ફોર્મ-બ ભરવાનું રહેશે.
- જે સ્પર્ધા જિલ્લાકક્ષા/રાજ્યકક્ષાએ સીધી શરૂ થાય છે તેમાં ભાગ લેનાર ખેલાડીઓએ સ્પર્ધા શરૂ થવાના દિન-૭ પહેલાં પોતાના જિલ્લાના જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે પોતાના નામ અને રમતની યાદી જન્મના પુરાવા સાથે રજૂ કરવાની રહેશે.

તા././૨૦૨૪

સ્થળ:-

ખેલાડીની સહી

વેબસાઇટ: <https://khelmahakumbh.gujarat.gov.in>

# સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત

(ફોર્મ-બ)

રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર

ખેલ મહાકુંભ ૩.૦

સાંઘિક રમત માટે ટીમની યાદીનું પ્રવેશ પત્ર  
(કોઈ પણ બે જ રમતમાં ભાગ લઈ શકાશે)

૧. ટીમનું નામ/શાળાનું નામ /  
કોલેજ/સંસ્થાનું નામ/  
ડબલ્સ અને મિક્સ ડબલ્સ  
માટેના નામ

પ્રથમ પાર્ટનરનું નામ	બીજા પાર્ટનરનું નામ

૨. રમતનું નામ

૩. સંપર્ક નંબર

૪. ખેલાડીના નામ

: અટક નામ પિતાનું નામ

૧. \_\_\_\_\_
૨. \_\_\_\_\_
૩. \_\_\_\_\_
૪. \_\_\_\_\_
૫. \_\_\_\_\_
૬. \_\_\_\_\_
૭. \_\_\_\_\_
૮. \_\_\_\_\_
૯. \_\_\_\_\_
૧૦. \_\_\_\_\_
૧૧. \_\_\_\_\_
૧૨. \_\_\_\_\_
૧૩. \_\_\_\_\_
૧૪. \_\_\_\_\_
૧૫. \_\_\_\_\_
૧૬. \_\_\_\_\_

## બાહેંધરી:-

૧. સ્પર્ધા દરમિયાન કોઈ પણ જાતની શારીરિક હાની થશે તો તેની જવાબદારી મારી અને મારા વાલીની રહેશે. આયોજકની કોઈ જવાબદારી રહેશે નહીં.
૨. હું રજિસ્ટ્રેશન સમગ્ર રાજ્યમાંથી ફક્ત એકજ સ્થળેથી કરીશ અન્યથા મારું રજિસ્ટ્રેશન રદબાતલ ગણાશે.
૩. હું \_\_\_\_\_ આથી બાહેંધરી આપુ છું કે જો હું ખેલ મહાકુંભમાં વિજેતા/પસંદગી પામીશ તો સ્પર્ધા સ્થળે મારા જોખમે દર્શાવેલ સમય કરતાં પહેલાં ઉપસ્થિત રહીશ.
૪. દરેક સાંઘિક જ રમત માટે ફોર્મ-અ અને ફોર્મ-બ ભરવું ફરજિયાત છે.

તા. \_\_\_/\_\_\_/૨૦૨૪

સ્થળ:- \_\_\_\_\_

વેબસાઈટ: <https://khelamahakumbh.gujarat.gov.in>

\_\_\_\_\_

ખેલાડીની સહી

<b>અંક ૯ (તા.૦૧/૦૧/૨૦૧૬ અને તે પછી જન્મેલા)</b>	
(જે રમતમાં ભાગ લેવાનો હોય તેની સામે <input checked="" type="checkbox"/> કરવી (એક જ રમતમાં ભાગ લઈ શકશે.)	
<b>સીધી શાળા કક્ષાથી શરૂ થતી સ્પર્ધા</b>	
એથલેટીક્સ	<input type="checkbox"/> ૩૦ મીટર <input type="checkbox"/> સ્ટેન્ડીંગ બ્રોડ જમ્પ
<b>અંક ૧૧ (તા.૦૧/૦૧/૨૦૧૪ અને તે પછી જન્મેલા)</b>	
(જે રમતમાં ભાગ લેવાનો હોય તેની સામે <input checked="" type="checkbox"/> કરવી (એક જ રમતમાં ભાગ લઈ શકશે.)	
<b>સીધી શાળા કક્ષાથી શરૂ થતી સ્પર્ધા</b>	
એથલેટીક્સ	<input type="checkbox"/> ૫૦ મીટર <input type="checkbox"/> સ્ટેન્ડીંગ બ્રોડ જમ્પ
<b>સીધી તાલુકા / ઝોન કક્ષાથી શરૂ થતી સ્પર્ધા</b>	
ચેસ	<input type="checkbox"/> ચેસ
<b>સીધી જિલ્લા/કોર્પોરેશન કક્ષાથી શરૂ થતી સ્પર્ધા</b>	
એથલેટીક્સ	<input type="checkbox"/> ૧૦૦ મીટર <input type="checkbox"/> લાંબી કુદ
સ્કેટીંગ	કવોડ <input type="checkbox"/> રીંક ૧ (૫૦૦ મી.) <input type="checkbox"/> રીંક ૨ (૧૦૦૦ મી.)
	ઈનલાઈન <input type="checkbox"/> રીંક ૩ (૫૦૦ મી.) <input type="checkbox"/> રીંક ૪ (૧૦૦૦ મી.)
સ્વીમીંગ	<input type="checkbox"/> ૧૦૦ મીટર ફ્રી સ્ટાઇલ
વેડમીન્ટન	<input type="checkbox"/> સીંગલ્સ
ટેબલ ટેનીસ	<input type="checkbox"/> સીંગલ્સ
લોન ટેનીસ	<input type="checkbox"/> સીંગલ્સ
<b>સીધી રાજ્ય કક્ષાથી શરૂ થતી સ્પર્ધા</b>	
સ્વીમીંગ	વ્યક્તિગત મીડલે (૨૦૦ મીટર)
સ્કેટીંગ	કવોડ <input type="checkbox"/> રોડ ૧ (૧૫૦૦ મી.)
	ઈનલાઈન <input type="checkbox"/> રોડ ૨ (૫૦૦મી) <input type="checkbox"/> રોડ રેસ ૩ (૧૫૦૦મી)
<b>અંક ૧૪ (તા.૦૧/૦૧/૨૦૧૧ અને તે પછી જન્મેલા)</b>	
<b>સીધી શાળા કક્ષાથી શરૂ થતી સ્પર્ધા</b>	
એથલેટીક્સ	<input type="checkbox"/> ૧૦૦મીટર <input type="checkbox"/> લાંબીકુદ <input type="checkbox"/> ગોળા ફેંક
વોલીબોલ	<input type="checkbox"/> વોલીબોલ
ખો-ખો	<input type="checkbox"/> ખો-ખો
કબડ્ડી	<input type="checkbox"/> ભાઈઓ (૫૧ કિગ્રા) <input type="checkbox"/> બહેનો (૪૮ કિગ્રા)
<b>સીધી તાલુકા / ઝોન કક્ષાથી શરૂ થતી સ્પર્ધા</b>	
એથલેટીક્સ	<input type="checkbox"/> ૨૦૦ મીટર <input type="checkbox"/> ૪૦૦ મીટર <input type="checkbox"/> ૬૦૦ મીટર <input type="checkbox"/> ઉચીકુદ <input type="checkbox"/> ચક્રફેંક
ચેસ	<input type="checkbox"/> ચેસ
યોગાસન	<input type="checkbox"/> વ્યક્તિગત યોગા ચેમ્પિયનશીપ (ગ્રુપ A, B, C અને મનપસંદગીના આસનો)
<b>સીધી જિલ્લા/કોર્પોરેશન કક્ષાથી શરૂ થતી સ્પર્ધા</b>	
યોગાસન	<input type="checkbox"/> આર્ટિસ્ટિક યોગા(ટ્રેડિશનલ) <input type="checkbox"/> રિધમીક યોગા
આર્ચરી	<input type="checkbox"/> ઇન્ડિયન રાઉન્ડ (વ્યક્તિગત ઓવરશોલ)
સ્વીમીંગ	<input type="checkbox"/> ૧૦૦ મી.ફ્રી સ્ટાઇલ <input type="checkbox"/> બેક સ્ટ્રોક ૧૦૦ મી <input type="checkbox"/> બટર ફ્લાય સ્ટ્રોક ૧૦૦ મી.
	<input type="checkbox"/> ૪૦૦ મી.ફ્રી સ્ટાઇલ <input type="checkbox"/> બેસ્ટ સ્ટ્રોક ૧૦૦ મી <input type="checkbox"/> વ્યક્તિગત મીડલે ૨૦૦ મી.
આર્ટિસ્ટીક સ્કેટીંગ	<input type="checkbox"/> ફ્રી સ્કેટીંગ <input type="checkbox"/> સોલોડાન્સ <input type="checkbox"/> ફીગર <input type="checkbox"/> કવોટેટ
સ્કેટીંગ	કવોડ <input type="checkbox"/> રીંક ૧ (૫૦૦ મી.) <input type="checkbox"/> રીંક ૨ (૧૦૦૦ મી.)
	ઈનલાઈન <input type="checkbox"/> રીંક ૩ (૫૦૦ મી.) <input type="checkbox"/> રીંક ૪ (૧૦૦૦ મી.)
જુડો	ભાઈઓ <input type="checkbox"/> ૨૫ કિગ્રા સુધી <input type="checkbox"/> ૨૫-૩૦ કિગ્રા <input type="checkbox"/> ૩૦-૩૫ કિગ્રા <input type="checkbox"/> ૩૫-૪૦ કિગ્રા
	બહેનો <input type="checkbox"/> ૨૩ કિગ્રા સુધી <input type="checkbox"/> ૨૩-૨૭ કિગ્રા <input type="checkbox"/> ૨૭-૩૨ કિગ્રા <input type="checkbox"/> ૩૨-૩૬ કિગ્રા
કુસ્તી	ભાઈઓ <input type="checkbox"/> ૩૦-૩૫ કિગ્રા <input type="checkbox"/> ૩૫-૩૮ કિગ્રા <input type="checkbox"/> ૩૮-૪૧ કિગ્રા <input type="checkbox"/> ૪૧-૪૪ કિગ્રા <input type="checkbox"/> ૪૪-૪૮ કિગ્રા
	બહેનો <input type="checkbox"/> ૨૬-૩૦ કિગ્રા <input type="checkbox"/> ૩૦-૩૩ કિગ્રા <input type="checkbox"/> ૩૩-૩૬ કિગ્રા <input type="checkbox"/> ૩૬-૪૦ કિગ્રા <input type="checkbox"/> ૪૦-૪૪ કિગ્રા
ટેકવેન્ડો	ભાઈઓ <input type="checkbox"/> ૧૮ કિગ્રા સુધી <input type="checkbox"/> ૧૮-૨૧ કિગ્રા <input type="checkbox"/> ૨૩-૨૫ કિગ્રા <input type="checkbox"/> ૨૭-૨૯ કિગ્રા <input type="checkbox"/> ૪૧ કિગ્રાથી ઉપર
	બહેનો <input type="checkbox"/> ૧૬ કિગ્રા સુધી <input type="checkbox"/> ૧૮-૨૦ કિગ્રા <input type="checkbox"/> ૨૨-૨૪ કિગ્રા <input type="checkbox"/> ૨૬-૨૯ કિગ્રા <input type="checkbox"/> ૩૮ કિગ્રાથી ઉપર
વેડમીન્ટન	<input type="checkbox"/> સીંગલ્સ
બાસ્કેટબોલ	<input type="checkbox"/> બાસ્કેટબોલ
ટેબલ ટેનીસ	<input type="checkbox"/> સીંગલ્સ
લોન ટેનીસ	<input type="checkbox"/> સીંગલ્સ
હેન્ડબોલ	<input type="checkbox"/> હેન્ડબોલ
હોકી	<input type="checkbox"/> હોકી
કુટબોલ	<input type="checkbox"/> કુટબોલ
કરાટે	ભાઈઓ <input type="checkbox"/> ૨૦ કિગ્રા સુધી <input type="checkbox"/> ૨૦-૨૫ કિગ્રા <input type="checkbox"/> ૨૫-૩૦ કિગ્રા <input type="checkbox"/> ૩૦-૩૫ કિગ્રા <input type="checkbox"/> ૩૫-૪૦ કિગ્રા <input type="checkbox"/> ૪૦-૪૫ કિગ્રા <input type="checkbox"/> ૪૫-૫૦ કિગ્રા <input type="checkbox"/> ૫૦-૫૫ કિગ્રા <input type="checkbox"/> ૫૫-૬૦ કિગ્રા <input type="checkbox"/> ૬૦ કિગ્રાથી ઉપર
	બહેનો <input type="checkbox"/> ૧૮ કિગ્રા સુધી <input type="checkbox"/> ૧૮-૨૨ કિગ્રા <input type="checkbox"/> ૨૨-૨૪ કિગ્રા <input type="checkbox"/> ૨૪-૨૬ કિગ્રા <input type="checkbox"/> ૨૬-૩૦ કિગ્રા <input type="checkbox"/> ૩૦-૩૪ કિગ્રા <input type="checkbox"/> ૩૪-૩૮ કિગ્રા <input type="checkbox"/> ૩૮-૪૨ કિગ્રા <input type="checkbox"/> ૪૨-૪૬ કિગ્રા <input type="checkbox"/> ૪૬-૫૦ કિગ્રા <input type="checkbox"/> ૫૦ કિગ્રાથી ઉપર

નોંધ:- યોગાસન માટે,  
 > ગ્રુપ-Aપશ્ચિમોતાસન,સર્વોગાસન,મસ્ત્યાસન,અર્ધમત્સ્યેન્દ્રાસન,પુર્ણ ધનુરાસન, ઉત્તાન પાદાસન  
 > ગ્રુપ-B પુર્ણ ચક્રાસન, કુકુટાસન, ભુમાસનપુર્ણ, સલાભાસન, બક્રાસન,શિર્ષાસન  
 > ગ્રુપ-C સાંખ્યાસન, વ્યાધાસન, ઉર્ધ્વ કુકુટાસન, ઉત્તિશતિતિવાસન, પદ્મ મયુરાસન,ઉત્તિશ્યાપાદસ્તાસન  
 > રાજ્યકક્ષાએ બેસ્ટ એક ધ બેસ્ટ રમાશે.

નોંધ:- શાળાકક્ષાથી રાજ્યકક્ષા સુધીની સ્પર્ધા માટે  
 > યોગાસનમાં ખેલાડી ભ્રારા વધુમાં વધુ ૨ ઇવેન્ટમાં ભાગ લઈ શકશે.  
 > બે ઇવેન્ટમાં ભાગ લેવા માટે વ્યક્તિગત યોગા ચેમ્પિયનશીપ ઇવેન્ટની પસંદગી કરવાની ફરજિયાત રહેશે.  
 > એથલેટીક્સ રમતમાં વધુ માં વધુ ૨ ઇવેન્ટ અને ૧ રીલે ઇવેન્ટમાં ભાગ લઈ શકશે.  
 > સ્વીમીંગ રમતમાં વધુમાં વધુ ૩ ઇવેન્ટ અને ૨ રીલેમાં ભાગ લઈ શકશે.  
 > જિલ્લાકક્ષા અને રાજ્યકક્ષાએ સ્કેટીંગમાં કવોડ અથવા ઇનલાઇન બેમાંથી એક ઇવેન્ટમાં ભાગ લઈ શકશે  
 > કુસ્તી, ટેકવેન્ડો, બોક્સીંગ, કરાટે અને જુડોની રમતમાં કોઈ પણ એક વજન ગ્રુપમાં ભાગ લઈ શકશે.  
 > કુસ્તી, ટેકવેન્ડો, અને જુડોની રમતમાં કોઈ પણ એક વજન ગ્રુપમાં ભાગ લઈ શકશે.

એથલેટીક્સ		<input type="checkbox"/> ૮૦ મી. હર્ડલ્સ	<input type="checkbox"/> ૪ x ૧૦૦ મી રીલે
સ્વીમીંગ		<input type="checkbox"/> ફ્રી સ્ટાઈલ ૫૦મી	<input type="checkbox"/> ફ્રી સ્ટાઈલ ૨૦૦મી
જુડો		<input type="checkbox"/> ૪૦-૪૫ કિગ્રા	<input type="checkbox"/> ૪૫-૫૦ કિગ્રા
કુસ્તી		<input type="checkbox"/> ૪૮-૫૨ કિગ્રા	<input type="checkbox"/> ૫૨-૫૭ કિગ્રા
ટેકવેન્ડો		<input type="checkbox"/> ૨૧-૨૩ કિગ્રા	<input type="checkbox"/> ૨૫-૨૭ કિગ્રા
જીમનાસ્ટીક		<input type="checkbox"/> ફ્લોર એક્સાઈઝ	<input type="checkbox"/> વોલ્ટીંગ ટેબલ
સ્કેટીંગ		<input type="checkbox"/> સ્વોડ	<input type="checkbox"/> ઇનલાઈન
આર્ચરી		<input type="checkbox"/> રીકર્વ રાઉન્ડ	<input type="checkbox"/> કમ્પાઉન્ડ રાઉન્ડ
શુટીંગ		<input type="checkbox"/> ૧૦ મી. એર પીસ્તોલ	<input type="checkbox"/> ૧૦ મી. એર રાયફલ પીપ
બોક્સીંગ		<input type="checkbox"/> ૨૮-૩૦ કિગ્રા	<input type="checkbox"/> ૩૦-૩૨ કિગ્રા
મલાખંભ		<input type="checkbox"/> રોપ મલાખંભ	<input type="checkbox"/> પોલ મલાખંભ
રોલબોલ		<input type="checkbox"/> રોલબોલ	
સેપક ટકરાવ		<input type="checkbox"/> ટીમ ઇવેન્ટ	
સ્પોર્ટ્સ ક્લામીંગ		<input type="checkbox"/> લીડ ક્લામીંગ	<input type="checkbox"/> સ્પીડ ક્લામીંગ

### ખેલ મહાકુંભ ૩.૦

**અંદર ૧૭ (તા.૦૧/૦૧/૨૦૦૮ અને તે પછી જન્મેલા)**

જે રમતમાં ભાગ લેવાનો હોય તેની સામે  કરવી (એક જ રમતમાં ભાગ લઈ શકશે.)

#### સીધી શાળા કક્ષાથી શરૂ થતી સ્પર્ધા

એથલેટીક્સ	<input type="checkbox"/> ૧૦૦ મી.	<input type="checkbox"/> લાંબી કૂદ	<input type="checkbox"/> લંગડીફાળ કૂદ	<input type="checkbox"/> ગોળાકેંક
રસ્સાબંધ	<input type="checkbox"/> ભાઈઓ ૪૮૦ કિગ્રા	<input type="checkbox"/> બહેનો ૪૦૦ કિગ્રા	નોંધ: (૮ ખેલાડીઓનું કુલ વજન)	
વોલીબોલ	<input type="checkbox"/> વોલીબોલ			
ખો-ખો	<input type="checkbox"/> ખો-ખો			
કબડ્ડી	<input type="checkbox"/> ભાઈઓ (૫૫ કિગ્રા)	<input type="checkbox"/> બહેનો (૫૫ કિગ્રા)		

#### સીધી તાલુકા/ઝોનકક્ષાથી શરૂ થતી સ્પર્ધા

એથલેટીક્સ	<input type="checkbox"/> ૨૦૦મી	<input type="checkbox"/> ૪૦૦મી	<input type="checkbox"/> ૮૦૦ મી	<input type="checkbox"/> ૧૫૦૦ મી.	<input type="checkbox"/> ઉચીકૂદ	<input type="checkbox"/> બરછીકેંક	<input type="checkbox"/> ચક્રકેંક
ચેસ	<input type="checkbox"/> ચેસ						
યોગાસન	<input type="checkbox"/> વ્યક્તિગત યોગા ચેમ્પિયનશીપ (ગ્રુપ A, B, C અને મનપસંદગીના આસનો)						

#### સીધી જિલ્લા/કોર્પોરેશન કક્ષાથી શરૂ થતી સ્પર્ધા

આર્ચરી	<input type="checkbox"/> ઇન્ડિયન રાઉન્ડ (વ્યક્તિગત ઓવરશોલ)						
યોગાસન	<input type="checkbox"/> આર્થિસ્ટિક યોગા(ટ્રેડિશનલ) <input type="checkbox"/> રિધમીક યોગા						
સ્વીમીંગ		<input type="checkbox"/> ૧૦૦ મી.ફ્રી સ્ટાઈલ	<input type="checkbox"/> બેક સ્ટ્રોક ૧૦૦ મી	<input type="checkbox"/> બટર ફ્લાય સ્ટ્રોક ૧૦૦ મી.			
સ્કેટીંગ		<input type="checkbox"/> ૪૦૦ મી.ફ્રી સ્ટાઈલ	<input type="checkbox"/> બેસ્ટ સ્ટ્રોક ૧૦૦ મી	<input type="checkbox"/> વ્યક્તિગત મીડલે ૨૦૦ મી.			
જુડો		<input type="checkbox"/> ૪૦ કિગ્રા સુધી	<input type="checkbox"/> ૪૦-૪૫ કિગ્રા	<input type="checkbox"/> ૪૫-૫૦ કિગ્રા	<input type="checkbox"/> ૫૦-૫૫ કિગ્રા	<input type="checkbox"/> ૫૫-૬૦ કિગ્રા	
કુસ્તી		<input type="checkbox"/> ૪૧-૪૫ કિગ્રા	<input type="checkbox"/> ૪૫-૪૮ કિગ્રા	<input type="checkbox"/> ૪૮-૫૧ કિગ્રા	<input type="checkbox"/> ૫૧-૫૫ કિગ્રા	<input type="checkbox"/> ૫૫-૬૦ કિગ્રા	
ટેકવેન્ડો		<input type="checkbox"/> ૩૫ કિગ્રા સુધી	<input type="checkbox"/> ૩૫ -૩૮ કિગ્રા	<input type="checkbox"/> ૪૧-૪૫ કિગ્રા	<input type="checkbox"/> ૪૮-૫૧ કિગ્રા	<input type="checkbox"/> ૫૫-૫૮ કિગ્રા	<input type="checkbox"/> ૭૮ કિગ્રા થી ઉપર
બેડમીન્ટન		<input type="checkbox"/> સીંગલ્સ					
બાસ્કેટબોલ		<input type="checkbox"/> બાસ્કેટબોલ					
ટેબલ ટેનીસ		<input type="checkbox"/> સીંગલ્સ					
લોન ટેનીસ		<input type="checkbox"/> સીંગલ્સ					
હેન્ડબોલ		<input type="checkbox"/> હેન્ડબોલ					
હોકી		<input type="checkbox"/> હોકી					
કુટબોલ		<input type="checkbox"/> કુટબોલ					
કરાટે		<input type="checkbox"/> ૩૫ કિગ્રા સુધી	<input type="checkbox"/> ૩૫-૪૦ કિગ્રા	<input type="checkbox"/> ૪૦-૪૫ કિગ્રા	<input type="checkbox"/> ૪૫-૫૦ કિગ્રા	<input type="checkbox"/> ૫૦-૫૪ કિગ્રા	<input type="checkbox"/> ૫૪-૫૮ કિગ્રા
રગ્બી		<input type="checkbox"/> રગ્બી					

જીમનાસ્ટીક સ્પર્ધામાં ખેલાડી કોઈ પણ બે ઇવેન્ટમાં ભાગ લઈ શકશે  
જીમનાસ્ટીક સ્પર્ધામાં નિયમ પ્રમાણે ભાઈઓએ ૬ (છ) પેટા રમત અને બહેનોએ ૪ (ચાર) પેટા રમતમાં ભાગ લેવાનો રહેશે.

શુટીંગ સ્પર્ધામાં સ્પર્ધકોએ શુટીંગ માટે પોતાની રાઈફલ લાવવાની રહેશે. ત્રણમાંથી કોઈ પણ બે ઇવેન્ટમાં ભાગ લઈ શકશે.  
શુટીંગ સ્પર્ધામાં એર પીસ્તોલની એક અથવા એર રાયફલ બે ઇવેન્ટમાં ભાગ લઈ શકશે

નોંધ:- યોગાસન માટે.  
ગ્રુપ-અપક્ષિતોત્સાન, સર્વાંગાસન, મસ્ત્યાસન, અર્ધમ.સેન્ડાસન, પૂર્ણ ધનુરાસન, ઉત્તાન પાદાસન  
ગ્રુપ-ક પૂર્ણ ચક્રાસન, કુકુલાસન, ભુમાસનપૂર્ણ, સલભાસન, બક્ષાસન, ત્રિપાસન  
ગ્રુપ- C સાંખ્યાસન, વ્યાધ્રાસન, ઉર્ધ્વ કુકુલાસન, ઉત્તિશ્રાતિતિવાસન, પક્ષ મથુરાસન, ઉત્તિશ્રાતિતિવાસન  
રાજ્યકક્ષાએ બેસ્ટ ઓફ ધ બેસ્ટ રમાશે.

નોંધ:- શાળાકક્ષાથી રાજ્યકક્ષા સુધીની સ્પર્ધા માટે  
યોગાસનમાં ખેલાડી બંને વધુ ૩ ઇવેન્ટમાં ભાગ લઈ શકશે.  
બે ઇવેન્ટમાં ભાગ લેવા માટે વ્યક્તિગત યોગા ચેમ્પિયનશીપ ઇવેન્ટની પસંદગી કરવાની ફરજિયાત રહેશે.  
યોગાસનમાં ખેલાડી બંને વધુ ૩ ઇવેન્ટમાં ભાગ લઈ શકશે.  
બે ઇવેન્ટમાં ભાગ લેવા માટે વ્યક્તિગત યોગા ચેમ્પિયનશીપ ઇવેન્ટની પસંદગી કરવાની ફરજિયાત રહેશે.  
એથલેટીક્સ રમતમાં વધુ માં વધુ ૩ ઇવેન્ટ અને ૧ રીલે ઇવેન્ટમાં ભાગ લઈ શકશે.  
સ્વીમીંગ રમતમાં વધુમાં વધુ ૩ ઇવેન્ટ અને ૨ રીલેમાં ભાગ લઈ શકશે.  
જિલ્લાકક્ષા અને રાજ્યકક્ષાએ સ્કેટીંગમાં કવોડ અથવા ઇનલાઈન બેમાંથી એક ઇવેન્ટમાં ભાગ લઈ શકશે  
કુસ્તી, ટેકવેન્ડો, બોક્સીંગ, કરાટે અને જુડોની રમતમાં કોઈ પણ એક વજન ગ્રુપમાં ભાગ લઈ શકશે.



રઝબી	<input type="checkbox"/> રઝબી
<b>❖ સીધી રાજ્ય કક્ષાથી શરૂ થતી સ્પર્ધા ❖</b>	
એથલેટીક્સ	<input type="checkbox"/> ૫૦૦મી <input type="checkbox"/> ૧૧૦ મી હર્ડલ્સ ભાઈઓ <input type="checkbox"/> ૧૦૦ મી. હર્ડલ્સ(બહેનો) <input type="checkbox"/> ૪૦૦મી હર્ડલ્સ <input type="checkbox"/> ૪ x ૧૦૦મી. રીલે <input type="checkbox"/> ૪ x ૪૦૦ મી.રીલે <input type="checkbox"/> વાંસફૂદ <input type="checkbox"/> હથોડા ફેક
સ્વીમીંગ	<input type="checkbox"/> ફ્રી સ્ટાઈલ ૫૦મી <input type="checkbox"/> ફ્રી સ્ટાઈલ ૨૦૦મી <input type="checkbox"/> ફ્રી સ્ટાઈલ ૮૦૦મી બહેનો <input type="checkbox"/> ફ્રીસ્ટાઈલ ૧૫૦૦ મી ભાઈઓ <input type="checkbox"/> ફ્રીસ્ટાઈલ રીલે ૪ x ૧૦૦મી.
	<input type="checkbox"/> બ્રેસ્ટ સ્ટ્રોક ૫૦ મી <input type="checkbox"/> બેક સ્ટ્રોક ૨૦૦ મી <input type="checkbox"/> બટર ફ્લાય ૫૦મી <input type="checkbox"/> બટર ફ્લાય સ્ટ્રોક ૨૦૦ મી
	<input type="checkbox"/> બેક સ્ટ્રોક ૫૦ મી <input type="checkbox"/> બ્રેસ્ટ સ્ટ્રોક ૨૦૦ મી <input type="checkbox"/> મીડલે રીલે ૪ x ૧૦૦મી <input type="checkbox"/> વ્યક્તિગત મીડલે ૪૦૦ મી
જુડો	ભાઈઓ <input type="checkbox"/> ૭૩-૮૧ કિગ્રા સુધી <input type="checkbox"/> ૮૧-૯૦ કિગ્રા <input type="checkbox"/> ૯૦-૧૦૦ કિગ્રા <input type="checkbox"/> ૧૦૦ કિગ્રાથી ઉપર
	બહેનો <input type="checkbox"/> ૫૭-૬૩ કિગ્રા સુધી <input type="checkbox"/> ૬૩-૭૦ કિગ્રા <input type="checkbox"/> ૭૦-૭૮ કિગ્રા <input type="checkbox"/> ૭૮ કિગ્રા થી ઉપર
કુસ્તી	ભાઈઓ <input type="checkbox"/> ૭૪-૭૯ કિગ્રા <input type="checkbox"/> ૭૯-૮૬ કિગ્રા <input type="checkbox"/> ૮૬-૯૨ કિગ્રા <input type="checkbox"/> ૯૨-૯૭ કિગ્રા <input type="checkbox"/> ૯૭-૧૨૫ કિગ્રા
	બહેનો <input type="checkbox"/> ૫૯-૬૨ કિગ્રા <input type="checkbox"/> ૬૨-૬૫ કિગ્રા <input type="checkbox"/> ૬૫-૬૮ કિગ્રા <input type="checkbox"/> ૬૮-૭૨ કિગ્રા <input type="checkbox"/> ૭૨-૭૬ કિગ્રા
ટેકવેન્ડો	ભાઈઓ <input type="checkbox"/> ૪૮-૫૧ કિગ્રા <input type="checkbox"/> ૫૧-૫૫ કિગ્રા <input type="checkbox"/> ૫૬-૬૩ કિગ્રા <input type="checkbox"/> ૬૩-૬૮ કિગ્રા <input type="checkbox"/> ૭૩-૭૮ કિગ્રા <input type="checkbox"/> ૭૮ કિગ્રાથી ઉપર
	બહેનો <input type="checkbox"/> ૪૦-૪૨ કિગ્રા <input type="checkbox"/> ૪૨-૪૪ કિગ્રા <input type="checkbox"/> ૪૪-૪૬ કિગ્રા <input type="checkbox"/> ૪૬-૪૯ કિગ્રા <input type="checkbox"/> ૪૯-૫૨ કિગ્રા
આર્ચરી	રીકર્વ રાઉન્ડ <input type="checkbox"/> વ્યક્તિગત ઓવરચોલ <input type="checkbox"/> વ્યક્તિગત એલિમીનેશન રાઉન્ડ <input type="checkbox"/> ટીમ <input type="checkbox"/> મીક્ષ ટીમ
	કમ્પાઉન્ડ રાઉન્ડ <input type="checkbox"/> વ્યક્તિગત ઓવરચોલ <input type="checkbox"/> વ્યક્તિગત એલિમીનેશન રાઉન્ડ <input type="checkbox"/> ટીમ <input type="checkbox"/> મીક્ષ ટીમ
જીમ્નાસ્ટીક	ભાઈઓ <input type="checkbox"/> ફ્લોર એક્સાઈઝ <input type="checkbox"/> વોલ્ટીંગ ટેબલ <input type="checkbox"/> રોમનરીંગ <input type="checkbox"/> પેરલલબાર <input type="checkbox"/> પોમેલહોર્સ <input type="checkbox"/> હોરિજોન્ટલબાર
	બહેનો <input type="checkbox"/> ફ્લોર એક્સાઈઝ <input type="checkbox"/> વોલ્ટીંગ ટેબલ <input type="checkbox"/> બેલેસીંગબીમ <input type="checkbox"/> અન ઈવનબાર
સ્નેટીંગ	ફ્લોર <input type="checkbox"/> રોડ ૧ (૩૦૦૦ મી.)
	ઈન લાઈન <input type="checkbox"/> રોડ ૨ (૫૦૦ મી.) <input type="checkbox"/> રોડ ૩ (૩૦૦૦ મી.)
સાઈકલીંગ	<input type="checkbox"/> ૨૦ કી.મી.
શુટીંગ	રાઇફલ ગ્રુપ <input type="checkbox"/> ૧૦ મી. એર રાયફલ પીપ <input type="checkbox"/> ૫૦ મી. ૦.૨૨ રાઇફલ ૩ પોજિશન
	પિસ્તોલ ગ્રુપ <input type="checkbox"/> ૧૦ મી. એર પિસ્તોલ <input type="checkbox"/> ૦.૨૨ રેપીડ ફાયર (ભાઈઓ) <input type="checkbox"/> ૦.૨૨ સ્પોર્ટ્સ પિસ્તોલ (બહેનો)
	ટ્રેપ ગ્રુપ <input type="checkbox"/> શોટગન ટ્રેપ <input type="checkbox"/> શોટગન ડબલ ટ્રેપ
વેઈટલીફ્ટીંગ	ભાઈઓ <input type="checkbox"/> ૫૫ કિગ્રા <input type="checkbox"/> ૬૧ કિગ્રા <input type="checkbox"/> ૬૭ કિગ્રા <input type="checkbox"/> ૭૩ કિગ્રા <input type="checkbox"/> ૮૧ કિગ્રા <input type="checkbox"/> ૮૯ કિગ્રા <input type="checkbox"/> ૯૬ કિગ્રા <input type="checkbox"/> ૧૦૨ કિગ્રા <input type="checkbox"/> ૧૦૯ કિગ્રા <input type="checkbox"/> ૧૦૯ કિગ્રા થી ઉપર
	બહેનો <input type="checkbox"/> ૪૫ કિગ્રા <input type="checkbox"/> ૪૯ કિગ્રા <input type="checkbox"/> ૫૫ કિગ્રા <input type="checkbox"/> ૫૯ કિગ્રા <input type="checkbox"/> ૬૫ કિગ્રા <input type="checkbox"/> ૭૧ કિગ્રા <input type="checkbox"/> ૭૬ કિગ્રા <input type="checkbox"/> ૮૧ કિગ્રા <input type="checkbox"/> ૮૭ કિગ્રા <input type="checkbox"/> ૮૭ કિગ્રા થી ઉપર
ક્રેન્સીંગ	<input type="checkbox"/> ક્લેઈલ <input type="checkbox"/> ઈંપી <input type="checkbox"/> સેબર
બોક્સીંગ	ભાઈઓ <input type="checkbox"/> ૪૬-૪૮ કિગ્રા <input type="checkbox"/> ૪૮-૫૧ કિગ્રા <input type="checkbox"/> ૫૧-૫૪ કિગ્રા <input type="checkbox"/> ૫૪-૫૭ કિગ્રા <input type="checkbox"/> ૫૭-૬૦ કિગ્રા <input type="checkbox"/> ૬૦-૬૩.૫ કિગ્રા <input type="checkbox"/> ૬૩.૫-૬૭ કિગ્રા <input type="checkbox"/> ૬૭-૭૧ કિગ્રા <input type="checkbox"/> ૭૧-૭૫ કિગ્રા <input type="checkbox"/> ૭૫-૮૦ કિગ્રા
	બહેનો <input type="checkbox"/> ૪૫-૪૮ કિગ્રા <input type="checkbox"/> ૪૮-૫૦ કિગ્રા <input type="checkbox"/> ૫૦-૫૨ કિગ્રા <input type="checkbox"/> ૫૨-૫૪ કિગ્રા <input type="checkbox"/> ૫૪-૫૭ કિગ્રા <input type="checkbox"/> ૫૭-૬૦ કિગ્રા <input type="checkbox"/> ૬૦-૬૩ કિગ્રા <input type="checkbox"/> ૬૩-૬૬ કિગ્રા <input type="checkbox"/> ૬૬-૭૦ કિગ્રા <input type="checkbox"/> ૭૦-૭૫ કિગ્રા
બીચ હેન્ડબોલ	<input type="checkbox"/> બીચ હેન્ડબોલ
બીચ વોલીબોલ	<input type="checkbox"/> બીચ વોલીબોલ
ધોડેસવારી	<input type="checkbox"/> જમ્પીંગ (ભાઈઓ) <input type="checkbox"/> એન્થ્રોપ્સ(ભાઈઓ)
મલાખંબ	<input type="checkbox"/> રોપ મલાખંબ (ફકત બહેનો માટે) <input type="checkbox"/> પોલ મલાખંબ (ફકત ભાઈઓ માટે)
સોકર ટેનીસ	<input type="checkbox"/> સીગલ્સ <input type="checkbox"/> ડબલ્સ
સ્પોર્ટ્સ ક્લામીંગ	<input type="checkbox"/> લીડ ક્લામીંગ <input type="checkbox"/> સ્પીડ ક્લામીંગ <input type="checkbox"/> બોલ્ડરીંગ
વુડબોલ	ફેરપ્લે <input type="checkbox"/> સીગલ્સ <input type="checkbox"/> ડબલ્સ <input type="checkbox"/> ટીમ
	સ્ટ્રોક <input type="checkbox"/> સીગલ્સ <input type="checkbox"/> ડબલ્સ <input type="checkbox"/> ટીમ

➢ જીમ્નાસ્ટીક સ્પર્ધામાં ખેલાડી કોઈ પણ બે ઇવેન્ટમાં ભાગ લઈ શકશે

➢ શુટીંગ સ્પર્ધામાં સ્પર્ધકોએ શુટીંગ માટે પોતાની રાઇફલ લાવવાની રહેશે.

➢ બધી જ સ્પર્ધાઓ ઈન્ટર નેશનલ શુટીંગ સ્પોર્ટ્સ ડેવેલપમેન્ટ (ISSF)ના નિયમો મુજબ યોજાશે

➢ શુટીંગ સ્પર્ધામાં રાઇફલ અથવા પિસ્તોલ અને ટ્રેપ ગ્રુપમાં કોઈપણ બે ઇવેન્ટમાં ભાગ લઈ શકશે

### ખેલ મહાકુંભ ૩.૦

<b>૪૦ વર્ષથી ઉપર (તા.૦૧/૦૧/૧૯૬૫ થી તા.૩૧/૧૨/૧૯૮૪ દરમ્યાન જન્મેલા)</b>	
જે રમતમાં ભાગ લેવાનો હોય તેની સામે	<input checked="" type="checkbox"/> કરવી (એક જ રમતમાં ભાગ લઈ શકશે.)
<b>❖ સીધી ગ્રામ્યકક્ષાએથી શરૂ થતી સ્પર્ધા ❖</b>	
રસ્સાખેંચ	<input type="checkbox"/> ભાઈઓ ૫૬૦ કિગ્રા <input type="checkbox"/> બહેનો ૪૮૦ કિગ્રાનોંધ: (૮ ખેલાડીઓનું કુલ વજન)
<b>❖ સીધી તાલુકા/ઝોનકક્ષાએથી શરૂ થતી સ્પર્ધા ❖</b>	
ચેસ	<input type="checkbox"/> સ્પર્ધા નોંધ:- અબોવ-૪૦ અને અબોવ-૬૦ માટે બેડમિન્ટન, ટેબલ ટેનીસ અને ટેનીસ રમતમાં ૩ ઇવેન્ટમાંથી કોઈ પણ ૨ ઇવેન્ટમાં ભાગ લઈ શકશે.
<b>❖ સીધી જિલ્લા/કોર્પોરેશન કક્ષાથી શરૂ થતી સ્પર્ધા ❖</b>	
શુટીંગ બોલ	<input type="checkbox"/> ફકત ભાઈઓ માટે
બેડમિન્ટન	<input type="checkbox"/> સીગલ્સ <input type="checkbox"/> ડબલ્સ <input type="checkbox"/> મિક્સ ડબલ્સ
ટેબલ ટેનીસ	<input type="checkbox"/> સીગલ્સ <input type="checkbox"/> ડબલ્સ <input type="checkbox"/> મિક્સ ડબલ્સ
લોન ટેનીસ	<input type="checkbox"/> સીગલ્સ <input type="checkbox"/> ડબલ્સ <input type="checkbox"/> મિક્સ ડબલ્સ
સ્વીમીંગ	<input type="checkbox"/> ૫૦ મી.ફ્રી સ્ટાઈલ <input type="checkbox"/> ૧૦૦ મી.ફ્રી સ્ટાઈલ <input type="checkbox"/> ૫૦ મી બેક સ્ટ્રોક
	<input type="checkbox"/> ૫૦ મી બ્રેસ્ટ સ્ટ્રોક <input type="checkbox"/> ૫૦મી.બટર ફ્લાય સ્ટ્રોક
<input type="checkbox"/> સ્વીમીંગ રમતમાં કોઈપણ ૩ ઇવેન્ટમાં ભાગ લઈ શકશે.	
<b>❖ સીધી રાજ્ય કક્ષાથી શરૂ થતી સ્પર્ધા ❖</b>	
યોગાસન	<input type="checkbox"/> કોમ્બીનેશન યોગ ચેમ્પીયન શીપ

નોંધ:-યોગાસન માટે (રાજ્યકક્ષા)

અબોવ-૪૦ માં માત્ર એક જ ઇવેન્ટમાં ભાગ લઈ શકાશે.

➢ આગળ જુકવાનું આસન:- પશ્ચિમોતાસન, ભુમાસન, ઉત્થિતપાદઆસન, કુર્માસન, યોગાસન

➢ પાછળ જુકવાનું આસન:- ચક્રાસન, ધનુરાસન, ઉષ્ટ્રાસન, ભુંજગાસન, સેતુબંધાચસન

➢ કમળને વળાંક આપનું આસન:-પૂર્ણમત્તેન્દ્રઆસન, કમરમરોડાસન, વક્રાસન, હાથનું સમતુલન આસન, પગનું સમતુલન આસન

## 50 વર્ષથી ઉપર (તા.૩૧/૧૨/૧૯૬૪ અને તે પહેલા જન્મેલા)

જે રમતમાં ભાગ લેવાનો હોય તેની સામે <input checked="" type="checkbox"/>		કરવી (એક જ રમતમાં ભાગ લઈ શકશે.)
<b>☞ સીધી ગ્રામ્યકક્ષાએથી શરૂ થતી સ્પર્ધા ☜</b>		
રસ્સાખેંચ	<input type="checkbox"/> ભાઈઓ ૬૨૦ કિગ્રા <input type="checkbox"/> બહેનો ૪૮૦ કિગ્રાનોંધ: (૮ ખેલાડીઓનું કુલ વજન)	
<b>☞ સીધી તાલુકા / ઝોન કક્ષાએથી શરૂ થતી સ્પર્ધા ☜</b>		
ચેસ	<input type="checkbox"/> સ	
<b>☞ સીધી જિલ્લા/કોર્પોરેશન કક્ષાથી શરૂ થતી સ્પર્ધા ☜</b>		
બેડમીન્ટન	<input type="checkbox"/> સીંગલ્સ <input type="checkbox"/> ડબ્લ્સ <input type="checkbox"/> મિક્સ ડબ્લ્સ	નોંધ:-યોગાસન માટે (રાજ્યકક્ષા) અબોવ-૬૦ માં માત્ર એક જ ઇવેન્ટમાં ભાગ લઈ શકાશે. ૫ આસનો કરવાના રહેશે.આગળ જુકવાનું આસન,પાછળ જુકવાનું આસન,કમળને વળાંક આપતું આસન, હાથનું સમતુલન આસન, પગનું સમતુલન આસન
ટેબલ ટેનીસ	<input type="checkbox"/> સીંગલ્સ <input type="checkbox"/> ડબ્લ્સ <input type="checkbox"/> મિક્સ ડબ્લ્સ	
લોન ટેનીસ	<input type="checkbox"/> સીંગલ્સ <input type="checkbox"/> ડબ્લ્સ <input type="checkbox"/> મિક્સ ડબ્લ્સ	
સ્વીમીંગ	<input type="checkbox"/> ૫૦ મી.ફી સ્ટાઈલ <input type="checkbox"/> ૧૦૦ મી.ફી સ્ટાઈલ <input type="checkbox"/> ૫૦ મી બેક સ્ટ્રોક <input type="checkbox"/> ૫૦ મી બ્રેસ્ટ સ્ટ્રોક <input type="checkbox"/> ૫૦ મી.બટર ફ્લાય સ્ટ્રોક	
<b>☞ સીધી રાજ્ય કક્ષાથી શરૂ થતી સ્પર્ધા ☜</b>		
યોગાસન	<input type="checkbox"/> કોમ્બીનેશન યોગ ચેમ્પીયન શીપ	

સ્વીમીંગ રમતમાં કોઈપણ ૩ ઇવેન્ટમાં ભાગ લઈ શકશે.